

Intake capacity for the PG admission  
2021-22 at NAU, Navsari

**જાહેરનામું**

આથી સંબંધકર્તા સર્વેને જણાવવાનું કે, નવસારી કૃષિ યુનિવર્સિટીની ૪૪મી વિદ્યા પરિષદની બેઠકના મુદ્દા નંબર ૪૪.૦૫ થી નીચે મુજબ થયેલ ઠરાવનો અમલ તાત્કાલીક અસરથી કરવાનો રહેશે.

“The Academic Council has resolved to approve the intake capacity of PG students for the academic year 2021-22 as per Appendix-I for PG degree programs of various faculties as per ICAR.”

જા.નં.નકૃયુ/સંનિ/ટી-૩/ <sup>6789-6839</sup> / ૨૦૨૧  
તા. ૨૭/૦૮/૨૦૨૧

*Shankar*  
27-08-2021  
સંશોધન નિયામક અને  
અનુસ્નાતક વિદ્યાશાખાધ્યક્ષ  
નવસારી કૃષિ યુનિવર્સિટી  
નવસારી

**નકલ સવિનય રવાના :**

૧. વિદ્યા પરિષદના તમામ સભ્યશ્રીઓ તરફ.
૨. યુનિવર્સિટીના તમામ અધિકારીશ્રીઓ તરફ.
૩. તમામ આચાર્યશ્રીઓ તરફ
૪. તમામ યુનિટ /હેડ/ યુનિટ અધિકારીશ્રીઓ

**નકલ રવાના :**

૧. કુલસચિવશ્રીના રહસ્ય સચિવશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી.
૨. સંશોધન નિયામકશ્રીના રહસ્ય સચિવશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી.

## Appendix-I

### PG Intake for the academic year 2021-22: Faculty –Agriculture

UG seats		240	90% of 240 = 216			
PG seats		Masters		Doctoral		
Total seats		139		42		
NAU	75 % of total seats	104.25	<b>104</b>	31.5	<b>32</b>	
ICAR	25% of total seats	34.75	<b>35</b>	10.5	<b>10</b>	

### Agriculture

Sr.No	Name of Disciplines	M.Sc.						Ph.D.			
		NAU		ICAR	Total	EWS		NAU	ICAR	Total	EWS
		Navsari	Bharuch			Navsari	Bharuch				
1	Agronomy	9	9	6	24	2	1	5	2	7	1
2	Agri.Chem & Soil Sci.	3	1	1	5	1	0	2	1	3	0
3	Agri. Entomology	14	1	5	20	2	0	4	1	5	1
4	Plant Pathology	13	4	5	22	2	0	4	1	5	1
5	Genetics & PB	13	3	6	22	2	0	8	3	11	1
6	Plant Physiology	1	0	1	2	0	0	0	0	0	0
7	Agri. Economics	5	0	1	6	0	0	2	0	2	0
8	Extension Education	6	3	3	12	1	0	3	1	4	0
9	Agri. Statistics	2	0	1	3	0	0	0	0	0	0
10	Agri. Meteorology	3	0	1	4	0	0	0	0	0	0
11	Agri. Microbiology	6	0	2	8	1	0	2	1	3	0
12	Biochemistry	2	0	1	3	0	0	1	0	1	0
13	Plant Molecular Biology & Biotechnology	6	0	2	8	1	0	1	0	1	0
	Sub total	<b>83</b>	21			12	1				
<b>Total</b>		<b>104</b>		<b>35</b>	<b>139</b>	<b>13</b>		<b>32</b>	<b>10</b>	<b>42</b>	<b>4</b>
<b>EWS</b>		<b>13</b>						<b>4</b>			

\*Seats of PH category will be adjusted in the respective category

**PG Intake for the academic year 2021-22: Faculty –Horticulture**

UG seats	66=79	90% of 66	59.4=59
PG seats	Masters	Doctoral	
Total seats	40	14	
<b>M.Sc.</b>			
NAU	75 % of total (total seats 33)	30	<b>30</b>
ICAR	25% of total (total seats 33)	10	<b>10</b>
<b>Doctoral</b>			
NAU	75 % of total (total seats 11)	10.5	<b>11</b>
ICAR	25% of total (total seats 11)	3.5	<b>3</b>

Sr.No	Name of Disciplines	M.Sc.				Ph.D.			
		NAU	ICAR	Total	EWS	NAU	ICAR	Total	EWS
1	Fruit Science	9	4	13	1	4	1	5	1
2	Floriculture and Landscape Architecture	6	2	8	1	3	1	4	0
3	Vegetable Science	8	2	10	1	2	1	3	0
4	Post Harvest Technology	5	1	6	1	2	0	2	0
5	Plantation Crops, Spices, Medicinal Plants and Aromatic Plants	2	1	3	0	0	0	0	0
	<b>Total</b>	<b>30</b>	<b>10</b>	<b>40</b>	<b>4</b>	<b>11</b>	<b>3</b>	<b>14</b>	<b>1</b>
<b>EWS</b>		<b>4</b>				<b>1</b>			

**\*Seats of PH category will be adjusted in the respective category**

**PG Intake for the academic year 2021-22: Faculty –Forestry**

UG seats		66	90% of 60	59.4=59	
PG seats		Masters		Doctoral	
Total seats		28		6	
NAU	75 % of Total seats	21	<b>21</b>	4.5	<b>5</b>
ICAR	25% of Total seats	7	<b>7</b>	1.5	<b>1</b>

Sr.No	Name of Disciplines	M.Sc.				Ph.D.			
		NAU	ICAR	Total	EWS	NAU	ICAR	Total	EWS
1	Silviculture & Agroforestry	8	3	11	1	2	1	3	0
2	Forest Biology & Tree Improvement	5	2	7	1	2	0	2	0
3	Forest Product Utilization	4	1	5	1	0	0	0	0
4	Natural Resources Management	2	1	3	0	1	0	1	0
<b>Total</b>		<b>19</b>	<b>7</b>	<b>26</b>	<b>3</b>	<b>5</b>	<b>1</b>	<b>6</b>	<b>0</b>
<b>EWS</b>		<b>3</b>				<b>0</b>			

**\*Seats of PH category will be adjusted in the respective category**

**PG Intake for the academic year 2021-22: Faculty – Agriculture Engineering**

UG seats	30	90% of 30 = <b>27</b>
PG seats	Masters	Doctoral
Total seats	14	0

Sr.No	Name of Discipline	M.Tech.		Ph.D.
		NAU	EWS	NAU
1	Farm Machinery and Power Engineering	4	0	0
2	Soil & Water Conservation Engineering	6	1	0
3	Renewable Energy Engineering	4	0	0
<b>Total</b>		<b>14</b>	<b>1</b>	<b>0</b>
<b>EWS</b>		<b>1</b>		

**PG Intake for the academic year 2021-22: Faculty - MBA**

Sr.No	Name of Disciplines		MBA Masters			MBA Doctoral	
			NAU	ICAR	Total	NAU	
1	Agribusiness Management		24 (75% of 32)	8 (25% of 32)	32	3	
<b>EWS</b>			<b>3</b>				
	General	13	<b>*Seats of PH category will be adjusted in the respective category</b>			<b>3</b>	
	OBC (27%)	6				0	
	SC (7%)	1				0	
	ST(15%)	3				0	
	PH (3%)*	1				0	